

ફોરેક્સ કાર્ડ અરજી ફોર્મ

અરજદારની વ્યક્તિગત વિગતો

પૂરું નામ* શ્રીમાન/સુશ્રી/શ્રીમતિ/ડો.: _____ જન્મતારીખ* DD / MM / YYYY

First Name

Middle Name

Last Name

જાતિ*: પુરુષ/સ્ત્રી/ટ્રાન્સજેન્ડર માતાનું પ્રથમ નામ*: _____ કસ્ટમર આઈડી: _____ પાસપોર્ટ નંબર*: _____

પાસપોર્ટ જારી કર્યાની તારીખ*: DD / MM / YYYY જારી કર્યાનું સ્થળ* _____ પાસપોર્ટની સમાપ્તિ તારીખ*: DD / MM / YYYY

સરનામું* _____

_____ દેશ _____ પિનકોડ*:

--	--	--	--	--	--	--	--	--	--

 પાન નંબર*:

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

જન્મનો દેશ: _____ નાગરિકતા / રાષ્ટ્રીયતા: _____

કન્દ્રી કોડ

--	--	--	--

 મોબાઇલ નંબર

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

 ઇમેઇલ આઈડી* _____

કર નિવાસનો દેશ*: _____ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર (ટીઆઇએન)*:

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

*યુએસએને સામેલ કરવા, જ્યાં વ્યક્તિ નાગરિક/ગ્રીનકાર્ડ ધારક છે; બહુવિધ દેશના કિસ્સામાં, કૃપા કરીને ટીઆઇએનની સાથે તમામ દેશોનાં નામનો ઉલ્લેખ કરો

કાર્ડધારકનો વ્યવસાય*: પગારદાર/સ્વરોજગાર/ નિવૃત્ત/ સ્વરોજગાર વ્યાવસાયિક/ ગૃહિણી/ રાજકારણી/ વિદ્યાર્થી/ અન્ય _____

જો પગારદાર તો, *પ્રાઇવેટ લિમિટેડ/ભાગીદારી/પ્રોપ્રિયેટરશીપ/પબ્લિક લિમિટેડ/જાહેર ક્ષેત્ર/સરકાર/બહુરાષ્ટ્રીય/અન્ય સાથે કાર્યરત છે _____

જો સ્વરોજગાર* તો, _____ વર્ષથી સ્થાપના તારીખ*: DD / MM / YYYY

કારોબારનો પ્રકાર*: ઉત્પાદન/સેવા પ્રદાતા/કૃષિ/બુલિયન અથવા સોના અથવા ઝવેરાત/સ્ટોકબ્રોકર/રિઅલ એસ્ટેટ/ટ્રેડર/નાણાં ધિરનાર/અન્ય _____

કંપની ફર્મનો પ્રકાર: એકલ સ્વામીત્વ/ભાગીદારી કંપની/પ્રાઇવેટ લિમિટેડ કંપની/પબ્લિક લિમિટેડ કંપની/અન્ય _____

સ્વરોજગાર વ્યવસાય*: ડોક્ટર/સીએ/સીએસ/વકીલ/આર્કિટેક્ટ/આઈટી વ્યાવસાયિક/અન્ય _____

એકંદર વાર્ષિક આવક*: ☐ < 1L ☐ 1L – 5L ☐ 5L – 10L ☐ 10L – 50L ☐ >50L

ભંડોળનો સ્ત્રોત*: પગાર/કારોબાર/કૃષિ/રોકાણ આવક/અન્ય/શૈક્ષણિક લોન/પોતાનું ભંડોળ/અન્ય લોન અથવા ઋણ _____

નાણાકીય સંસ્થાનું નામ, જ્યાંથી શિક્ષણ લોન પ્રાપ્ત કરવામાં આવી હોય: _____

રહેઠાણનો પ્રકાર: માલિકીનું/ ભાડે/ પૂર્વજનું/ કંપની દ્વારા ભંડોળ પૂરું પાડેલ

રાજકીય રીતે વગ ધરાવતી વ્યક્તિ (પીઇપી) / પીઇપીના સંબંધી અથવા નજીકના સહયોગી*: હા ☐ ના ☐

જો ઘોષિત કરવામાં આવ્યું છે, ના:

- (i) હું અહીં પુષ્ટિ અને ઘોષિત કરું છું કે હું રાજકીય રીતે વગ ધરાવતી વ્યક્તિ(ઓ) નથી (ભારતીય રિઝર્વ બેંક માસ્ટર નિર્દેશ – નો ચોર કસ્ટમર (કેવાયસી) નિર્દેશ, 2016ની વ્યાખ્યા અનુસાર) અથવા રાજકીય રીતે વગ ધરાવતી વ્યક્તિના સંબંધી નથી.
- (ii) હું અહીં સંમત છું કે જો ઉપરોક્ત ઘોષણાં ખોટી હોવાની જાણ થાય તો બેંક મને જારી કરેલા ખાતા/ ફોરેક્સ કાર્ડને બંધ કરવાનો અને તમામ ચુકવવાની બાકી ચુકવણી, જો કોઇ હોય તો તેની તાત્કાલિક ધોરણે માગણી કરવાનો અધિકાર ધરાવે છે.
- (iii) ઘોષણામાં કોઇ ફેરફારની ઘટનામાં અને/ અથવા જો હું પછીથી રાજકીય વગ ધરાવતી વ્યક્તિ(ઓ) અથવા રાજકીય વગ ધરાવતી વ્યક્તિના સંબંધી બનું તો મારા માટે ખાતું ખોલ્યા / ફોરેક્સ કાર્ડ મને જારી કર્યા પછી, હું અહીં ત્વરિત તેના વિશે બેંકને સૂચિત કરવા અને એચડીએફસી બેંકની શાખા ખાતે સંબંધિત રાજકીય વગ ધરાવતી વ્યક્તિ (પીઇપી) ઘોષણાં ફોર્મ તાત્કાલિક ધોરણે રજૂ કરવા માટે સંમત છું.

ફોરેક્સ કાર્ડ જારી કરવાની વિગતો

કાર્ડ પસંદ કરો: ☐ મલ્ટિકરન્સી ફોરેક્સપ્લસ કાર્ડ ☐ રેગાલિયા ફોરેક્સપ્લસ કાર્ડ ☐ આઇએસઆઇસી સ્ટુડન્ટ ફોરેક્સપ્લસ કાર્ડ ☐ હજી ઉમરાહ ફોરેક્સપ્લસ કાર્ડ

પ્રવાસના દેશ/શો*: _____ પ્રવાસની તારીખ*: DD / MM / YYYY

પ્રવાસનો ઉદ્દેશ*: ☐ વ્યક્તિગત ☐ કારોબાર ☐ શિક્ષણ ☐ ઇમિગ્રેશન ☐ રોજગાર વિદેશ ☐ તબીબી સારવાર

સર્વોત્તમ સેવા પૂરી પાડતા દેશનું નામ: _____ દ્વારા ભંડોળ આપેલ: ☐ વ્યક્તિગત ☐ કોર્પોરેટ

ફોરેક્સ કાર્ડ સંદર્ભ નંબર

--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--	--

 તારીખ ____/____/20____. શાખાનો કોડ _____

લોડ/રિલોડ કરવામાં આવનારી ચલણોની વિગતો*:

ચલણ	એફસીવાય રકમ

*આખરી કુલ મૂલ્ય ચલણ રૂપાંતરણ દર, ટીસીએસ, જીએસટી, ચલણ રૂપાંતરણ શુલ્ક, જારી કરવાની ફી અને અન્ય લાગુ થવા પાત્ર દર અથવા શુલ્કને આધિન હોય છે.

કૃપા કરીને નોંધ લો કે, તમારું ફોરેક્સ કાર્ડ માત્ર એટીએમ વિઢોવલ અને પીઓએસ વ્યવહારો માટે ડિઢોલ્ટ રીતે સક્ષમ હોય છે.

શું તમે નામાંકિત કરવા માગો છો ☐ હા ☐ ના ☐

નામાંકન ફોર્મ

બેંક થાપણોનાં સંબંધમાં બેંકિંગ નિયમન ધારા, 1949ની સેક્શન 45ઝેડએ અને બેંકિંગ કંપનીઓ (નામાંકન) નિયમો, 1985ના નિયમ 2(1) હેઠળ નામાંકન હું (નામ) _____ (સરનામું) _____

_____ નીચેની વ્યક્તિ/ઓને નામાંકિત કરું છું. જેમને મારા/ અમારા/ સગીરોનાં મૃત્યુની ઘટનામાં એચડીએફસી બેંક દ્વારા ઉપરનાં ખાતામાં રહેલી થાપણની રકમને પરત કરવામાં આવી શકે છે (નામાંકિત વ્યક્તિનું નામ) _____ (નામાંકિત વ્યક્તિનું સરનામું) _____

થાપણદાર સાથેનો સંબંધ, જો કોઇ હોય તો _____ વય _____ વર્ષ જો નામાંકિત વ્યક્તિ સગીર હોય જન્મની તારીખ: તારીખ/મહિનો/વર્ષ જો નામાંકિત વ્યક્તિ સગીર હોય તો હું (નામ) _____ સગીર _____

સરનામું: _____

સાથેનો સંબંધ _____ ને નામાંકિત વ્યક્તિની સગીર વય દરમિયાન મારા/ અમારા/ સગીરનાં મૃત્યુની ઘટનામાં નામાંકિત વ્યક્તિના પક્ષે થાપણની રકમ પ્રાપ્ત કરવા માટે એપોઇન્ટ કરું છું

સાક્ષીની સહી* x _____ પ્રાથમિક અરજદારની સહી**: (કૃપા કરીને પાનાની પાછળ સહી જુઓ)

સાક્ષીનું નામ _____ પ્રાથમિક અરજદારનું નામ: _____

સાક્ષીનું સરનામું: _____ તારીખ: _____ સ્થળ: _____

*અંગૂઠાનાં નિશાનના કિસ્સામાં, નામાંકનની વિગતો પરિશિષ્ટમાં ભરવાની રહેશે

**જ્યાં થાપણ સગીરનાં નામે કરવામાં આવી હોય ત્યાં નામાંકન પર સગીરના પક્ષે કાર્ય કરવા માટે કાયદાકીય રીતે હકદાર વ્યક્તિ દ્વારા સહી કરવી જોઇએ

તમારા ફોરેક્સ કાર્ડ પર લાગુ થવા પાત્ર ફી અને શુલ્ક

(એ) ફી અને શુલ્ક:

ક્રમાંક	વિગતો	કાર્ડ પ્રકાર			
		મલ્ટિકરન્સી ફોરેક્સપ્લસ કાર્ડ	રેગાલિયા ફોરેક્સપ્લસ કાર્ડ	આઇએસઆઇસી સ્ટુડન્ટ ફોરેક્સપ્લસ કાર્ડ	હજી ઉમરાહ ફોરેક્સપ્લસ કાર્ડ
1	જારી કરવાની ફી	રૂ. 500 + જીએસટી	રૂ. 1000 + જીએસટી	રૂ. 300 + જીએસટી	રૂ. 200 + જીએસટી
2	રિલોડ ફી	રૂ. 75 + જીએસટી	રૂ. 75 + જીએસટી	રૂ. 75 + જીએસટી	રૂ. 75 + જીએસટી
3	એટીએમ વિઢોવલ ફી	\$2 અથવા અન્ય ચલણમાં સમકક્ષ	\$4	\$2 અથવા અન્ય ચલણમાં સમકક્ષ	\$2 અથવા અન્ય ચલણમાં સમકક્ષ
4	બેલેન્સ તપાસવાની ફી	\$0.5 અથવા અન્ય ચલણમાં સમકક્ષ	\$0.5	\$0.5 અથવા અન્ય ચલણમાં સમકક્ષ	\$0.5 અથવા અન્ય ચલણમાં સમકક્ષ
5	કોસ કરન્સી માર્કઅપ શુલ્ક*	2%	0%	3%	3%
6	બેક-અપ કાર્ડ શુલ્ક	રૂ. 100 + જીએસટી	રૂ. 100 + જીએસટી	સેવા ઉપલબ્ધ નથી	સેવા ઉપલબ્ધ નથી
7	કાર્ડ રિપ્લેસમેન્ટ શુલ્ક	રૂ. 100 + જીએસટી	રૂ. 100 + જીએસટી	સેવા ઉપલબ્ધ નથી	રૂ. 100 + જીએસટી

*કોસ કરન્સી માર્કઅપ શુલ્ક

- ઉપયોગમાં લેવામાં આવેલા વિનિમય દર વ્યવહાર/ મર્યન્ત પતાવટના સમયે પ્રચલિત વિઝા/ માસ્ટરકાર્ડ હોલસેલ વિનિમય દર અનુસાર હશે.
- વ્યવહારની ચલણ ફોરેક્સ કાર્ડ પર ઉપલબ્ધ ચલણ કરતા અલગ હોય એવા વ્યવહારો માટે, કોસ કરન્સી માર્ક-અપ શુલ્ક લાદવામાં આવશે.
- ફોરેક્સ કાર્ડ પર ઉપલબ્ધ ચલણોની અંદર વોલેટથી વોલેટ ટ્રાન્સફરને સામેલ કરતા કોસ કરન્સી વ્યવહારો માટે કોસ કરન્સી માર્ક-અપ લાદવામાં આવશે.
- જીએસટી પ્રચલિત દર અનુસાર સંબંધિત ફી અને શુલ્ક માટે ઉપલબ્ધ હશે.

(બી) મર્યાદા:

એટીએમ રોકડ ઉપાડ માટે દૈનિક મર્યાદા	5,000 યુએસ ડોલર સુધી અથવા અન્ય કોઇ ચલણમાં સમકક્ષ
ઓનલાઇન શુંખલાઓ મારફતે દૈનિક રિલોડ મર્યાદા	5,000 યુએસ ડોલર સુધી અથવા અન્ય કોઇ ચલણમાં સમકક્ષ
ઓનલાઇન શુંખલાઓ મારફતે વાર્ષિક રિલોડ મર્યાદા	25,000 યુએસ ડોલર સુધી અથવા અન્ય કોઇ ચલણમાં સમકક્ષ
લિબરેટેડ રેમિટન્સ સ્કિમ અનુસાર વાર્ષિક કુલ લોડ અને રિલોડ મર્યાદા*	નાણાકીય વર્ષમાં અન્ય કોઇ ચલણમાં મહત્તમ યુએસ ડોલર 250,000 અથવા સમકક્ષ (અથવા આરબીઆઇ દ્વારા નિર્ધારિત)

*નોંધ: લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમ (એલઆરએસ), એવી સુવિધા છે, જેમાં તમામ નિવાસી વ્યક્તિઓ (એફઇએમએ 1999 હેઠળ વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે), સગીરો+ સહિત કોઇ પણ વ્યક્તિને સ્વીકાર્ય ચાલુ અથવા મૂડી ખાતા વ્યવહાર અથવા બંનેનાં સંયોજન માટે નાણાકીય વર્ષ (એપ્રિલ – માર્ચ)દીઠ 250,000 યુએસ ડોલર સુધી મુક્તપણે રેમિટ કરવાની મંજૂરી છે.

+ ફોરેક્સ કાર્ડ ગ્રાહકને 12 વર્ષ કરતા વધુ સમય માટે જારી કરી શકાય છે.

(સી) ચલણ રૂપાંતરણ વેરો:

લોડ, રિલોડ અને રિફંડ વ્યવહારો પર લાગુ થવા પાત્ર.

ફોરેક્સ ચલણ ખરીદો અને વેચો		સેવા વેરાની રકમ
રૂ. 1 લાખ સુધી		એકંદર મૂલ્યના 0.18% અથવા રૂ. 45 (બંનેમાંથી જે ઊંચું હોય)
> રૂ. 1 લાખ રૂ. 10 લાખ સુધી		રૂ. 1 લાખથી વધુની રકમના રૂ. 180 + 0.09%
> રૂ. 10 લાખ		રૂ. 10 લાખથી વધુની રકમના રૂ. 990 + 0.018%

(ડી) ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ)

ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) નાણાકીય ધારા, 2020ની જોગવાઈ હેઠળ લાગુ થવા પાત્ર છે.

ક્રમાંક	યુકવણીનો પ્રકાર	1 ઓક્ટોબર, 2023થી અમલી દર
I	લોન દ્વારા ભંડોળ પ્રાપ્ત શિક્ષણ માટે એલઆરએસ	રૂ. 7 લાખ સુધી શૂન્ય
		રૂ. 7 લાખથી ઉપર 0.5%
II	તબીબી સારવાર/ શિક્ષણ માટે એલઆરએસ (લોન દ્વારા ભંડોળ પ્રાપ્ત સિવાય અન્ય)	રૂ. 7 લાખ સુધી શૂન્ય
		રૂ. 7 લાખથી ઉપર 0.5%
III	અન્ય ઉદ્દેશો માટે એલઆરએસ	રૂ. 7 લાખ સુધી શૂન્ય
		રૂ. 7 લાખથી ઉપર 0.5%
IV	વિદેશી ટુર પ્રોગ્રામ પેકેજની ખરીદી	રૂ. 7 લાખ સુધી 5%, ત્યાર પછી 20%
V	નિર્દિષ્ટ વ્યક્તિ કેટેગરી હેઠળ આવતી નિવાસી વ્યક્તિને નિષ્ક્રિય પાન/ નોન-સંબંધિત વર્ષ (જે વર્ષે ટીસીએસ ડિડક્ટ થશે, તેના અગાઉનાં વર્ષ) માટે આઇટીઆર રજૂ નહીં કરવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે	ટીસીએસના સામાન્યદરથી બમણા, મહત્તમ 20%થી વધશે નહીં

ડિસ્ક્લેઇમર:

- ઉપર ઉલ્લેખ કરેલી વિગતો નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર ફેરફારને આધિન છે અને ગ્રાહક અપડેટ થયેલી માહિતી માટે બેંકની વેબસાઇટ જોઇ શકે છે.
- કૃપા કરીને નોંધ લો કે ફોરેક્સ કાર્ડ ધારકનો પાન નંબર આરબીઆઇને એલઆરએસ રિપોર્ટિંગ માટે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સને ટીસીએસ રિપોર્ટિંગ માટે ધ્યાનમાં લેવામાં આવશે.

☐ હું સ્વાગત કિટના નિયમો અને શરતોના ભાગ, ફી અને શુલ્ક, વેરા અને મર્યાદાઓ, જે એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડને લાગુ થવા પાત્ર છે, તેમને સમજું છું અને સંમત છું.

સહી (કૃપા કરીને પાછળના પાના પર સહી જુઓ)

ફોરેઇન એકાઉન્ટ ટેક્સ કમ્પ્લાયન્સ એક્ટ (એફએટીસીએ) / કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (સીઆરએસ) ઘોષણા

એફએટીસીએ અને સીઆરએસ હેઠળ વિગતો

(કૃપા કરીને જો આવશ્યક લાગે તો, તમારા કર નિવાસ પર વધુ માર્ગદર્શન માટે તમારા વ્યાવસાયિક વેરાના સલાહકારની સલાહ લો)

- ઓળખ પ્રકાર અને ઓળખ નંબર (વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે રજૂ કરેલા દસ્તાવેજો)
- રજૂ કરેલા દસ્તાવેજનું નામ (પાન/પાસપોર્ટ): _____ ઓળખ નંબર (પાન/પાસપોર્ટ): _____
- કૃપા કરીને લાગુ થવા પાત્ર કર નિવાસી ઘોષણા પર નિશાન કરો: (કોઇ એક)*

એ ☐ હું ભારતનો નિવાસી છું અને અન્ય કોઇ દેશનો નિવાસી નથી (જો વિકલ્પ એ પસંદ કરવામાં આવે તો વિકલ્પ બી અને નીચે આપેલ કોષ્ટક ભરવાની જરૂર નથી) અથવા

બી. ☐ હું નીચે આપેલા કોષ્ટકમાં ઉલ્લેખ કરેલા દેશ/દેશોનો કર નિવાસી છું (જો વિકલ્પ બી પસંદ કરવામાં આવે તો નીચે આપેલા કોષ્ટકમાં વિગતો ભરો)

દેશ #	કર ઓળખ નંબર %	ઓળખ પ્રકાર (ટીઆઇએન અથવા અન્ય%, કૃપા કરીને સ્પષ્ટ કરો)
કર નિવાસ દેશનો ઉલ્લેખ કરો દા.ત. યુએસએ	કર ઓળખ નંબરનો ઉલ્લેખ કરો દા.ત. એએસડીએફ 1234	(કર ઓળખ નંબરનો પ્રકાર) દા.ત. સોશિયલ સિક્યોરિટી નંબર

યુએસએ સામેલ કરવા માટે પણ, જ્યાં વ્યક્તિ યુએસએના નાગરિક/ ગ્રીનકાર્ડ ધારક છે
% કર ઓળખ નંબર ઉપલબ્ધ ન હોય એવા કિસ્સામાં, કૃપા કરીને કાર્યરત સમકક્ષ પૂરા પાડો \$

એફએટીસીએ ઘોષણાની ખરાઇ માટે માન્ય દસ્તાવેજો પાસપોર્ટ, ચુંટણી ઓળખપત્ર, પાન કાર્ડ, આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, યુઆઇડીએઆઇ, એનઆરઇજીએ જોબ કાર્ડ અને અન્ય છે.

એફએટીસીએ - સીઆરએસ પ્રમાણપત્ર

હું આ ફોર્મ (અને નિયમો અને શરતો)ની માહિતીની આવશ્યકતાને સમજું છું અને અહીં પુષ્ટિ કરું છું કે મારા દ્વારા આ ફોર્મ પર પૂરી પાડવામાં આવેલી માહિતી સાચી, ખરી અને સંપૂર્ણ છે અને હું તેનો સ્વીકાર કરું છું.

સહી (કૃપા કરીને પાછળના પાના પર સહી જુઓ)

એફએટીસીએ - સીઆરએસ નિયમો અને શરતો:

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેક્ટ ટેક્સિસે 7 ઓગસ્ટ, 2015ના રોજ આવકવેરા નિયમો, 1962ના ભાગ તરીકે નિયમો 1114એફથી 114એચને સૂચિત કર્યા છે, જેના અનુસાર બેંક જેવી ભારતીય નાણાકીય સંસ્થાઓને અમારા તમામ ખાતાધારકો પાસેથી વધારાના વ્યક્તિગત વેરા અને લાભાર્થી માલિક માહિતી અને કેટલાક પ્રમાણપત્રો અને દસ્તાવેજો પ્રાપ્ત કરવા આવશ્યક છે. સંબંધિત કિસ્સાઓમાં, માહિતી ખાતામાંથી યોગ્ય રોક અથવા તેને સંબંધિત કોઇ આવક સુનિશ્ચિત કરવાના ઉદ્દેશો માટે વેરા અધિકારીઓ/ નિયુક્ત એજન્સીઓ/ વિથહોલ્ડિંગ એજન્ટ્સને સૂચના આપશે.

જો તમારા દ્વારા પૂરી પાડેલી કોઇ માહિતીમાં કોઇ ફેરફાર હોય તો કૃપા કરીને તમે અમને ત્વરિત એટલે કે માહિતીમાં ફેરફારની તારીખથી 30 દિવસની અંદર જાણ કરવાનું સુનિશ્ચિત કરશો.

જો તમને કર નિવાસ વિશે કોઇ પ્રશ્ન હોય તો કૃપા કરીને તમારા કર સલાહકારનો સંપર્ક કરો. જો તમે યુએસ નાગરિક અથવા નિવાસી અથવા ગ્રીનકાર્ડ ધારક હોય તો કૃપા કરીને યુએસ કર ઓળખ નંબરની સાથે વિદેશી દેશની માહિતીનાં ક્ષેત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ કરો. તમે જે દેશમાં કર નિવાસી હોય તેના ટીઆઇએન અથવા કાર્યરત સમકક્ષ પૂરા પાડવા ફરજિયાત છે, જે આવા ઓળખકર્તા જારી કરે છે. જો હજુ સુધી ટીઆઇએન ઉપલબ્ધ ન હોય અથવા હજુ સુધી જારી કર્યા ન હોય તો, કૃપા કરીને સ્પષ્ટતા પૂરી પાડો અને તેને ફોર્મની સાથે બિડો.

આવકવેરા ધારા, 1961 હેઠળ ઘોષણા

હું પુષ્ટિ કરું છું કે હું આવકવેરા ધારા 1961ની જોગવાઈ અનુસાર નિવાસી વ્યક્તિ છું.

(જો તમે આવકવેરા ધારા 1961 અનુસાર બિન-નિવાસી હોય તો વધારાની શીટમાં પ્રવર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતમાં તમારી અંદાજિત વેરાપાત્ર આવક પૂરી પાડો)

250,000 ડોલરની લિબરલાઇઝ્ડ રેમિટન્સ (એલઆરએસ) સ્કિમ હેઠળ વિદેશી ચલણની ખરીદી માટે ફોર્મએ2 અને ઘોષણા

(મધ્યસ્થ વેપારને આવરતા આયાત અને રેમિટન્સિસ સિવાયની ચુકવણીઓ માટે)

હું _____ (અરજદાર રેમિટરનું નામ) એચડીએફસી બેંકને નીચે આપેલી વિગતો પ્રમાણે મને ફોરેક્સ કાર્ડ જારી કરવાની વિનંતી કરું છું.

પાન: _____

સરનામું: _____

હું _____ (બેંકનું નામ)નો _____ ચેક નંબર બિડુ છું અને એચડીએફસી બેંકને મારા બચત બેંક/ ચાલુ/ આરએફસી/ ઇઇએફસી ખાતા નંબરમાંથી ફોરેક્સ કાર્ડ જારી કરવા માટેના શુલ્ક અને વેરા સહિત ડેબિટ કરવા માટે અધિકૃત કરું છું. પ્રવર્તમાન વિનંતીની વિગતો નીચે પ્રમાણે છે:

ચલણ	લોડ/રિલોડ રકમ

પ્રવર્તમાન નાણાકીય વર્ષ (એપ્રિલ - માર્ચ)માં લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમ હેઠળ કરવામાં આવેલા રેમિટન્સિસ/ થયેલા વ્યવહારોની વિગતો

ક્રમાંક	તારીખ	રકમ	એડી શાખા/ એફએફએમસી, જેના મારફતે વ્યવહાર કરવામાં આવ્યો છે તેનું નામ અને સરનામું.

ક્રમાંક	એલઆરએસ હેઠળ છે કે નહીં (હા/ના)	ઉદ્દેશ કોડ	વર્ણન		ઉદ્દેશ કેટેગરી	ઉદ્દેશ કોડ	ઉદ્દેશ કેટેગરી	ઉદ્દેશ કોડ
					વ્યક્તિગત	S0306	તબીબી સારવાર	S0304
					કારોબાર	S0301	શિક્ષણ	S0305
					રોજગાર	S1307	ઇમિગ્રેશન	S1307

* કૃપા કરીને બહુવિધ રેકૉર્ડ્સના કિસ્સામાં પરિશિષ્ટ ઉમેરો

નિવાસી વ્યક્તિઓ માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમ હેઠળ ઘોષણા:

1. હું/અમે અહીં ઘોષણા કરીએ છીએ કે આ અરજી સહિત નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં તમામ સ્રોતથી ખરીદેલી અથવા તેમના માધ્યમથી રેમિટ કરેલી વિદેશી ચલણની કુલ રકમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમ અનુસાર 250,000/- યુએસ ડોલર (માત્ર લે બાખ 50 હજાર યુએસ ડોલર)ની એકંદર મર્યાદાની અંદર છે અને પ્રમાણિત કરું છું/કરીએ છીએ કે ઉપરોક્ત રેમિટન્સ માટે ભંડોળનો સ્રોત મારી સાથે સંબંધ ધરાવે છે અને વિદેશી ચલણનો ઉપયોગ પ્રતિબંધિત ઉદ્દેશ માટે કરવામાં નહીં આવે.
2. તમારી પાસેથી ખરીદેલી વિદેશી ચલણ ફોર્મમાં સૂચિત ઉદ્દેશ માટે છે.
3. હું ભારતનો નિવાસી છું અને વિદેશી નાગરિક/ એનઆરઆઇ/ પીઆઇઓ નથી.
4. રેમિટન્સ માત્ર માન્ય મૂડી અને ચાલુ ખાતાના વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.
5. મેં મૂડી ખાતાના વ્યવહારો માટે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કિમ હેઠળ રેમિટ કરવા માટે કોઇ લોન/ ક્રેડિટ/ ઋણ લીધું નથી.
6. એફઇએમએ હેઠળ માન્ય ન હોય એવા કોઇ વ્યવહાર માટે રેમિટન્સની વિનંતી કરવામાં આવી રહી નથી અને વિદેશી એક્સચેન્જ/ વિદેશી પ્રતિપક્ષને માજિન અથવા માજિન કોલ્સ માટે રેમિટન્સની પ્રકૃતિમાં રેમિટન્સને યોજના હેઠળ મંજૂરી નથી.
7. આ સ્કિમ એફએટીએફ વેબસાઇટ www.Fatf-gafi.org ઉપલબ્ધ છે અથવા રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા સહકાર નહીં આપતા દેશો અને આતંકવાદીઓ તરીકે ઓળખેલા દેશોને મૂડી ખાતાનાં રેમિટન્સ માટે ઉપલબ્ધ નથી.
8. રેમિટન્સ/ ફોરેક્સ કાર્ડ વિદેશી ગૌણ બજારમાં ભારતીય કંપનીઓ દ્વારા જાહેર કરેલી એફસીસીબીની ખરીદી માટે મોકલવામાં/ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા નથી.
9. રેમિટન્સ/ ફોરેક્સ કાર્ડ વિદેશમાં વિદેશી ચલણમાં ટ્રેડિંગ અથવા સદ્ધ માટે મોકલવામાં/ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા નથી.

આધાર સૂચિત સંમતિ (જો આધાર પૂરું પાડવામાં આવ્યું હોય તો)

1. હુ સ્વૈચ્છિક રીતે આધાર ઓવીડી કેવાયસી અથવા ઇ-કેવાયસી અથવા ઓફલાઇન ખરાઇ માટેનો વિકલ્પ પસંદ કરું છું અને બેંકમાં મારો આધાર નંબર, વર્ચ્યુઅલ આઇડી, ઇ-આધાર, એક્સએમએલ, માસ્ક આધાર, આધારની વિગતો, વસતીવિષયક માહિતી, ઓળખ માહિતી, આધારમાં નોંધણી પામેલો મોબાઇલ નંબર, ચહેરાનાં પ્રમાણીકરણની વિગતો અને/અથવા બાયોમેટ્રિક માહિતી (સંયુક્ત રીતે “માહિતી”) રજૂ કરું છું.
2. મને બેંક દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે, કે:

(i) આધાર રજૂ કરવું ફરજિયાત નથી, અને કેવાયસી તથા ઓળખ સ્થાપિત કરવા માટેના વૈકલ્પિક વિકલ્પો છે, જેમાં આધાર સિવાયના સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજોથી ફિઝિકલ કેવાયસીની રીત સામેલ છે. તમામ વિકલ્પો મને આપવામાં આવ્યા હતા.

(iii) ઇ-કેવાયસી/ પ્રમાણીકરણ/ ઓફલાઇન ખરાઇ માટે, બેંક સીઆઇડીઆર/યુઆઇડીએઆઇ સાથે આધાર નંબર અને/અથવા બાયોમેટ્રિક્સ શેર કરશે અને સીઆઇડીઆર/યુઆઇડીએઆઇ બેંક સાથે પ્રમાણીકરણ ડેટા, આધાર ડેટા, વસતીવિષયક વિગતો, નોંધણી પામેલો મોબાઇલ નંબર, ઓળખ માહિતી શેર કરશે, જેનો ઉપયોગ નીચે ઉલ્લેખ કરેલા સૂચિત ઉદ્દેશો માટે કરવામાં આવશે.
3. હું બેંકને (અને તેના સેવા પ્રદાતાઓને) નીચેના સૂચિત ઉદ્દેશો માટે અધિકૃત કરું છું અને મારી સંમતિ આપું છું:

(i) પીએમએલ ધારા, 2002 અને તેના હેઠળના નિયમો અને આરબીઆઇની માર્ગદર્શિકા અનુસાર કેવાયસી અને સામયિક કેવાયસી પ્રક્રિયા, અથવા મારી ઓળખ સ્થાપવા માટે, મારી ઓળખ હાથ ધરવા, ઓફલાઇન ખરાઇ અથવા ઇ-કેવાયસી અથવા હા/ના પ્રમાણીકરણ, વસતીવિષય અથવા અન્ય પ્રમાણીકરણ/ખરાઇ/ઓળખ માટે, જે કાયદા પ્રમાણે માન્ય હોઇ શકે છે, તમામ ખાતાઓ, સુવિધાઓ, સેવાઓ માટે અને બેંકના/ તેના મારફતે પ્રવર્તમાન અને ભવિષ્યના સંબંધો માટે.

(iii) માહિતી એકત્રિત કરવી, આપ-લે કરવી, સંગ્રહિત કરવી, સાચવવી, રેકૉર્ડ્સ જાળવવા અને માહિતીનો ઉપયોગ કરવો તથા પ્રમાણીકરણ/ ખરાઇ/ ઓળખ રેકૉર્ડ્સ: (એ) ઉપરના સૂચિત ઉદ્દેશો માટે, (બી) નિયમનકારી અને કાનૂની રિપોર્ટિંગ અને ફાઇલિંગ માટે પણ અને/અથવા (સી) જ્યાં લાગુ થવા પાત્ર કાયદા હેઠળ આવશ્યક હોય ત્યાં;

(iii) આધાર સક્ષમ ચુકવણી સેવાઓ (એઇપીએસ) માટે મારા ખાતાને સક્ષમ કરવું;

(iv) અદાલત, કોઇ સત્તાધિકારી સમક્ષ અથવા આર્બિટ્રેશનમાં પૂરાવાના ઉદ્દેશો માટે સંમતિ, માહિતી અથવા પ્રમાણીકરણ, ઓળખ, ખરાઇ વગેરેના રેકૉર્ડ્સ અને લોગ્સ રજૂ કરવા.
4. હું સમજું છું કે આધાર નંબર અને કોર બાયોમેટ્રિક્સને કાયદા અનુસાર અને સીઆઇડીઆર જમા કરવા સિવાય સંગ્રહિત/ આપ-લે કરવામાં આવશે નહીં. મેં મારા આધાર નંબર પર નોંધણી પામેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત ઓટીપીનો ઉપયોગ કરીને મારી જાતે ઇ-આધાર ડાઉનલોડ કર્યું છું. આ દસ્તાવેજ યોગ્ય મળી ન આવે અથવા મારા દ્વારા પૂરી પાડેલી કોઇ ખોટી માહિતીના કિસ્સામાં હું બેંક અથવા તેના અધિકારીઓને જવાબદાર ઠેરવીશ નહીં.
- 5 ઉપરની સંમતિ અને માહિતી એકત્રિત કરવાનો ઉદ્દેશ મને મારી સ્થાનિક ભાષામાં સમજાવવામાં આવ્યો છે.

એફઇએમએ, 1999ના પ્રકરણ 11Aની સેક્શન 10(5) હેઠળ ઘોષણા ક્રમ બાંયધરી

1. હું/અમે અહીં ઘોષણા કરીએ છીએ કે ઉપર ઉલ્લેખ કરેલી વ્યવહારની વિગતોમાં ઉપરોક્ત ધારાની કોઇ જોગવાઈ અથવા તેના કોઇ નિયમ, નિયમન, જાહેરનામું, નિર્દેશ અથવા તેના હેઠળ આપેલા આદેશનાં ઉલ્લંઘન અથવા છટકવાનું સામેલ નથી અને તે ઉદ્દેશ માટે બનાવવામાં આવી નથી.
2. હું/અમે એ પણ સમજીએ છીએ કે જો હું/અમે એવી કોઇ આવશ્યકતાનું પાલન કરવાનો ઇન્કાર કરીએ છીએ અથવા માત્ર અસંતોષકારક પાલન કરીએ છીએ તો બેંક લેખિતમાં વ્યવહારને સમજવાથી ઇન્કાર કરશે અને જો તેની પાસે એ માનવાનું કારણ હોય કે કોઇ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તો ઇન્કાર કરશે. મારા/અમારા દ્વારા કોઇ છટકવાનું કૃત્ય કરવામાં આવ્યું છે તો આ બાબતની આરબીઆઇને જાણ કરો.
3. હું/અમે આની સાથે આવી માહિતી/દસ્તાવેજો આપવાનું વચન પણ આપીએ છીએ, જે ઉપરોક્ત ઘોષણાં અનુસાર આ વ્યવહાર અંગે તમને વ્યાજબી રીતે સંતુષ્ટ કરીશું.

સામાન્ય ઘોષણા

1. ઉપર ઉલ્લેખ કર્યા પ્રમાણેના ઉદ્દેશ અને વ્યવહાર મારા જ્ઞાન અનુસાર શ્રેષ્ઠ છે.
2. હું/અમે મારા/અમારા દ્વારા પૂરી પાડેલી કોઇ ખોટી માહિતી માટે જવાબદાર અને ઉત્તરદાયી હોઇશું.
3. ફોરેન્સ એક્સચેન્જ મેનેજમેન્ટ (ચાલુ ખાતા વ્યવહાર) નિયમ, 2000ના શિડ્યુઅલ II હેઠળ પ્રતિબંધિત કોઇ ઉદ્દેશ અથવા શિડ્યુઅલ II હેઠળ પ્રતિબંધિત કોઇ પણ આઇટમ માટે રેમિટન્સની વિનંતી કરવામાં આવી રહી નથી.
4. રેમિટન્સ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નેપાળ અને ભૂતાનને મોકલવામાં આવી રહ્યા નથી
5. રેમિટન્સ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એવી વ્યક્તિઓ અને એન્ટિટીઝને મોકલવામાં આવી રહ્યા નથી, જેમને આરબીઆઇ દ્વારા બેંકોને અલગ સલાહ આપવામાં આવ્યા પ્રમાણે આતંકવાદના કૃત્યો કરવાનાં નોંધપાત્ર જોખમ તરીકે ઓળખવામાં આવ્યા છે.
6. ઉપર ઉલ્લેખ કરેલા વ્યવહારમાં એવો કોઇ ઉદ્દેશ સામેલ નથી અને તેને એવા કોઇ ઉદ્દેશ માટે તૈયાર કરવામાં આવ્યો નથી, જેના માટે ફોરેઇન એક્સચેન્જ મેનેજમેન્ટ (ચાલુ ખાતા વ્યવહાર) નિયમ, 2000ના નિયમ 3 અને તેના શિડ્યુઅલ I હેઠળ વિદેશી ચલણના ઉપાડ પ્રતિબંધિત છે, જેમ કે:

એ. જીતેલી લોટરીમાંથી મોકલેલું રેમિટન્સ

બી. રેસિંગ/ રાઇડિંગ વગેરે અથવા અન્ય કોઇ શોખની આવકનું રેમિટન્સ

સી. લોટરી ટિકિટ, પ્રતિબંધિત/નિર્ધારિત સામયિકો, ફૂટબોલ પુલ, સ્વીપસ્ટેક્સ, નાણાં સક્યુલેશનને સામેલ કરતી યોજનાઓ, ઇનામનાં નાણાં/પુરસ્કાર પ્રાપ્ત કરવા વગેરે ખરીદવા માટે રેમિટન્સ

ડી. સંયુક્ત સાહસો/ ભારતીય કંપનીઓની વિદેશમાં સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓમાં ઇન્વેસ્ટી રોકાણ માટે કરવામાં આવેલી નિકાસ પર કમિશનની ચુકવણી

ઈ. કોઇ પણ કંપની દ્વારા ડિવિડન્ડનું રેમિટન્સ, જેના માટે ડિવિડન્ડ સમતુલનની આવશ્યકતા લાગુ થવા પાત્ર છે

એફ. રૂપી સ્ટેટ કેડિટ રૂપ હેઠળ નિકાસ પર કમિશનની ચુકવણી, આ અને તમાકુની નિકાસનાં ઇન્વોઇસ મૂલ્યના 10% સુધી કમિશન સિવાય

જી. ટેલિફોનની ‘કોલ-બેક સેવાઓ’ ને સંબંધિત ચુકવણી

એચ. નોન-રેસિડેન્ટ સ્પેશિયલ રૂપી એક્ઝેન્ડ સ્કિમમાં રાખેલા ભંડોળ પર વ્યાજની આવકનું રેમિટન્સ

આઇ. નેપાળ અને/અથવા ભૂતાનમાં યાત્રા

જે. નેપાળ અને ભૂતાનમાં રહેતી વ્યક્તિ સાથે વ્યવહાર
7. હું/અમે સંમત છીએ કે વિનંતી રજૂ કરવાનો અર્થ એ નથી કે વ્યવહારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એચડીએફસી બેંક નિયમનકારી અને આંતરિક માર્ગદર્શિકાઓને આધારે વ્યવહારનો અસ્વીકાર કરવાના સંપૂર્ણ અધિકારો ધરાવે છે
8. હું/અમે સંમત છીએ કે જો બેંકને પ્રક્રિયા માટે વિનંતી રજૂ કર્યા પછી મારા/અમારા ખાતામાં વ્યવહારોનાં અમલના સમયે અપૂરતા/ક્લિઅર ન થયેલા બેલેન્સને લીધે વ્યવહારો અમલી થઈ શક્યા ન હોય / મારા/અમારા ખાતામાં ડેબિટ થઈ ન શકે તો એચડીએફસી બેંક વ્યવહારની પ્રક્રિયા નહીં કરી શકવા માટે જવાબદાર નહીં હોય. ફોરેક્સ સોલો ઊલટાવાને પગલે આ સંબંધમાં થયેલા કોઇ વિનિમયના નુકસાનને મારા/અમારા એચડીએફસી બેંક ખાતામાંથી વસૂલવામાં આવશે.
9. હું/અમે સંમત છીએ કે જો બેંકને પ્રક્રિયા માટે વિનંતી રજૂ કર્યા પછી મારા/અમારા દ્વારા વ્યવહાર રદ કરવામાં આવે અથવા પાછો ખેંચવામાં આવે એવા કિસ્સામાં આ સંબંધમાં થયેલા કોઇ વિનિમયના નુકસાનને મારા/અમારા એચડીએફસી બેંક ખાતામાંથી વસૂલવામાં આવશે.
10. હું/અમે વધુમાં સંમત છીએ કે મારા/અમારા દ્વારા એક વખત રેમિટ કરેલા ભંડોળ એચડીએફસી બેંક દ્વારા સંવાદદાતા અને/અથવા લાભાર્થી બેંકોને ટ્રાન્સમિટ કરવામાં આવે ત્યાર પછી એચડીએફસી બેંક આવા ભંડોળનાં ડિસ્બર્સમેન્ટમાં કોઇ વિલંબ માટે જવાબદાર નહીં હોય, જેમાં સંવાદદાતા અને/લાભાર્થી બેંકો દ્વારા આવા ભંડોળને રોકી રાખવા સામેલ છે.
11. હું/અમે સંમત છીએ કે એક વખત ભંડોળ મારા/અમારા દ્વારા એચડીએફસી બેંક દ્વારા ટ્રાન્સમિટ થાય ત્યાર પછી સંવાદદાતા અને/અથવા લાભાર્થી બેંકો દ્વારા મધ્યસ્થી સેવા શુલ્ક લાદવામાં આવી શકે છે, જે બેંકથી બેંક અલગ હોઇ શકે છે
12. હું/અમે સંમત છીએ કે જો મારા દ્વારા રજૂ કરેલી ખોટી માહિતીને લીધે લાભાર્થી બેંક દ્વારા વ્યવહારનો અસ્વીકાર કરવામાં આવે તો લાભાર્થી બેંક દ્વારા લાદવામાં આવેલા કોઇ સેવા શુલ્ક અથવા આ સંબંધમાં થયેલા વિનિમય નુકસાનને એચડીએફએસી બેંક ખાતામાંથી વસૂલવામાં આવશે
13. હું/અમે ઘોષણા કરીએ છીએ કે નીચેના હસ્તાક્ષરકર્તા ફર્મ/ કંપનીના પક્ષે અરજી, ઘોષણા અને બાંચધરી આપવાનો સત્તાધિકાર ધરાવે છે. (જ્યારે અરજી/ ઘોષણા/ બાંચધરી ફર્મ/કંપનીના પક્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યા હોય ત્યારે લાગુ થવા પાત્ર)
14. હું/અમે અહીં અરજી પર સહી કરવાની/ભરવાની તારીખના રોજ એ ઘોષણા કરીએ છીએ, જે ઘોષણા મારા દ્વારા ફોરેક્સપ્લસ કાર્ડની સુવિધા અને/અથવા માન્ય ચલણ સુવિધાનો સતત લાભ પ્રાપ્ત કરવા દરમિયાન દરેક દિવસે મારા દ્વારા પુનરાવર્તિત થઈ હોવાનું માનવામાં આવશે, કે:

(એ) મારી વિરુદ્ધ કોઇ અદાલત, ન્યાયિક અથવા અર્ધ-ન્યાયિક સત્તાધિકારી અથવા કોઇ સરકારી અથવા વહીવટી એજન્સી/ સત્તાધિકારી સમક્ષ કોઇ વહીવટી, સિવિલ અને/અથવા ફોજદારી કેસ/કાર્યવાહી/તપાસ પેઢિંગ નથી;

(બી) મને કોઇ પણ અપરાધ અને/અથવા ગુનાનો આક્ષેપ/આરોપી/ દોષી ઠેરવવામાં આવ્યો નથી અને આ સંબંધમાં મારી સામે કોઇ આરોપ લગાવવામાં આવ્યા નથી.
- હું સમજું છું કે ઉપરોક્ત બાબતના સત્યતા અથવા ખરાપણા અંગે કોઇ ખોટી રજૂઆત કરી હોવાના કિસ્સામાં બેંક નીચેની બાબતો માટે હકદાર હશે:

(એ) તાત્કાલિક ધોરણે ફોરેક્સપ્લસ કાર્ડસ સુવિધા અને/અથવા માન્ય ચલણ સુવિધા બંધ કરવા/બ્લોક કરવા;

(બી) ભારતમાં અથવા અન્યથા કોઇ પણ અદાલત, ટ્રિબ્યુનલ, સરકારી અને/અથવા વહીવટી સત્તાધિકારી સમક્ષ મારા વિરુદ્ધ વહીવટી, સિવિલ અને/અથવા ફોજદારી કાર્યવાહી/કેસ શરૂ કરવા અથવા દાખલ કરવા અને આવી બાબતની જાણ ભારતીય રિઝર્વ બેંક અને/અથવા બેંકને પોતાના એક માત્ર વિવેકમાં યોગ્ય લાગી શકે એ પ્રમાણે અન્ય કોઇ સરકારી સત્તાધિકારી/એજન્સીને કરવા.

ફોરેક્સકાર્ડની ખરીદી પર સામાન્ય ઘોષણા:

- હું એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડ જારી કરવા માટે અરજી કરું છું, જેનો અર્થ છે કે હું એવી ઘોષણા કરું છું કે અરજીમાં સામેલ માહિતી સાચી અને ખરી છે તથા હું આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્ય ફોરેક્સ કાર્ડ માટે અરજી કરવા પાત્ર છું. જો આ અરજી સ્વીકારવામાં આવે તો હું સમયાંતરે અમલી હોઇ શકે એવા એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડને નિયંત્રિત કરતા નિયમો શરતો માટે બંધાયેલો રહીશ અને કાર્ડનો ઉપયોગ આ નિયમો અને શરતોનો સ્વીકાર કર્યો હોવાનું માનવામાં આવશે. હું એચડીએફસી બેંક અને/તેના સહયોગીઓને મારી ઓફિસ/રહેઠાણ પર કોઇ માહિતીની ખરાઇ કરવા માટે અથવા ખાતાને સારી સ્થિતિમાં જાળવી રાખવા માટે આવશ્યક હોઇ શકે એવી માહિતી પ્રાપ્ત કરવા અથવા પૂરી પાડવા માટે મારો, મારા રોજગારદાતા/ બેંકર/ કેડિટ બ્યુરો/ આરબીઆઇ અથવા અન્ય કોઇ સ્ત્રોત સાથે સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સમજું છું અને સ્વીકારું છું કે સ્થાનિક કાયદા અને ભારતીય રિઝર્વ બેંકના નિયમો અને નિયમનો વિદેશી ચલણની ખરીદી અને ઉપયોગ માટે ધોરણો અને મર્યાદાઓ નિર્ધારિત કરે છે. હું બાંચધરી આપું છું કે મારા દ્વારા એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડનો ઉપયોગ ભારતીય રિઝર્વ બેંકના વિનિમય નિયંત્રણ નિયમનો અને સમયાંતરે લાગુ થવા પાત્ર કાયદાઓ, વિશેષ રીતે અને મર્યાદા વિના, વિદેશી વિનિમય સંચાલન ધારા, 1999ને અનુસાર હશે. આમ કરવામાં મારા પક્ષે થતી કોઇ નિષ્ફળતાના કિસ્સામાં, મારા દ્વારા આપવામાં આવતી કોઇ માહિતી ખોટી અથવા અયોક્ષ્ય હોવાના કિસ્સામાં હું સંમત છું કે હું એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડની ખરીદી અને ઉપયોગને સંચાલિત કરતા સ્થાનિક કાયદા અને/ અથવા નિયમનો, જે અમલી હોઇ શકે છે, તેમના હેઠળ કોઇ/ તમામ દંડ અને/ અથવા કાર્યવાહી માટે એક માત્ર જવાબદાર હોઇશ.
- હું સંમત છું અને સ્વીકારું છું કે એચડીએફસી બેંક મને જારી કરવામાં આવેલા એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડને રિલોડ કરવા માટે કોઇ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી વિનંતીઓ પર કાર્યવાહી કરશે. મારા રોજગારદાતાની વિનંતી પર મને જારી કરવામાં આવેલા એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડના કિસ્સામાં હું અહીં એચડીએફસી બેંકને એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડને રિલોડ, રદ અને રિફંડ કરવા માટે મારા રોજગારદાતા દ્વારા કરેલી વિનંતીઓ પર કાર્યવાહી કરવા અધિકૃત કરું છું.
- એફએટીસીએ/ વિદેશી કર કાયદા હેઠળ વિગતો: કર નિયમનો અનુસાર બેંકને પ્રત્યેક વ્યક્તિના કર નિવાસ અંગે માહિતી એકત્રિત કરવાની જરૂર હોય છે. અમુક સંજોગોમાં (જો બેંક તમારી પાસેથી માન્ય સ્વ-પ્રમાણપત્ર પ્રાપ્ત ન થાય તે સહિત) અમે સંબંધિત કર સત્તાધિકારીઓની સાથે તમારા ખાતાની માહિતી આપ-લે કરવા માટે બંધાયેલા હોઇ શકીએ છીએ. જો તમારા કર નિવાસ અંગે તમને કોઇ પ્રશ્નો હોય તો કૃપા કરીને તમારા વેરાના સલાહકારનો સંપર્ક કરો. જો બેંકને પૂરી પાડેલી માહિતીમાં કોઇ ફેરફાર હોય તો કૃપા કરી સુનિશ્ચિત કરો કે તમે તેની ત્વરિત જાણ અમને 30 દિવસોની અંદર કરશો.
- હું સમજું છું અને એફઇએમએ માર્ગદર્શિકા અનુસાર મારો પ્રવાસ પૂર્ણ થયાના 180 દિવસની અંદર કાર્ડ પર 2,000 ડોલર (કે સમકક્ષ) કરતા વધુનાં મૂલ્યના ઉપયોગમાં નહીં લીધેલા શેષને સરન્દર કરવાની જવાબદારી લઉં છું
- હું સમજું છું કે એવી પરિસ્થિતિ હોઇ શકે છે જ્યારે ફોરેક્સ કાર્ડનો જરૂરથી વધુ ઉપયોગ થઈ શકે છે, જેને પગલે બેંકને કાર્ડધારકના પક્ષે ચુકવણી કરવી પડી શકે છે અને કાર્ડમાં નકારાત્મક શેષ થઈ શકે છે. હું સમજું છું અને બેંકને આ નકારાત્મક કાર્ડ શેષને ચુકવવા માટેની જવાબદારી લઉં છું, કારણ કે બેંકે મારા દ્વારા ઉપયોગમાં લીધેલા માલ/સેવાઓ માટે આ રકમની ચુકવણી કરી છે. હું એ પણ સ્વીકારું છું કે બેંક કોઇ પણ પૂર્વ સૂચના આપ્યા વિના મારા ખાતા અથવા બેંક સાથે રહેલા અન્ય કોઇ પ્રોપર્ટીઝ ફોરેક્સ કાર્ડમાંથી ડેબિટ કરીને નકારાત્મક કાર્ડ શેષને નિયમિત કરવાનો અધિકાર ધરાવે છે.
- હું સ્વીકારું છું કે બેંકને ખોટો કાર્ડ નંબર જણાવીને ખોટા કાર્ડ નંબરને રિલોડ કરવાનું જોખમ ધરાવું છું. હું સમજું છું કે બેંક તેના માટે જવાબદાર હોઇ શકે નહીં. હું સંમત છું અને સ્વીકારું છું કે ફી રિફંડ થઈ શકતી નથી.
- હું એચડીએફસી બેંકને એવી વિનંતીઓ પર કાર્યવાહી કરવા અધિકૃત કરું છું, જે એચડીએફસી બેંક મારા દ્વારા અથવા મારા પક્ષે કરવામાં આવેલી હોય એવું માનતી હોય. એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડને રિલોડ કરવાની એવી કોઇ વિનંતીઓને વ્યક્તિગત રીતે મારા દ્વારા કરવામાં આવેલી વિનંતી તરીકે માનવા માટે હકદાર હશે. એચડીએફસી બેંક કોઇ પણ રીતે મારી સાથે મૌખિક રીતે અથવા લેખિતમાં અથવા અન્યથા આવી વિનંતીઓ આપવાની પુષ્ટિ કરવા માટે બાધ્ય/ આવશ્યક નહીં હોય.
- હું સમજું છું કે એટીએમ/ઇડીસી ટર્મિનલ્સ મશીન છે અને સંચાલનમાં હોય તે દરમિયાન ત્રુટીઓ હોઇ શકે છે. હું એવા કોઇ પણ મશીન / મિકેનિકલ ત્રુટીઓ/ નિષ્ફળતાઓ માટે બેંકને ક્ષતિપૂર્તિ કરવા સંમત છું.
- હું સમજું છું કે એચડીએફસી બેંક લિમિટેડ (“બેંક”) દ્વારા ઓફર કરેલી એલર્ટ સુવિધા મને મારા કાર્ડ પર ઘટનાઓ અને વ્યવહારોના સંબંધમાં મારા નોંધણી પામેલા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર શોર્ટ મેસેજિંગ સર્વિસ (“એસએમએસ”) મારફતે કસ્ટમાઇઝ્ડ એલર્ટ મેસેજિસ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે.
- મેં બેંક દ્વારા ઓફર કરવામાં આવતી એલર્ટ સેવાને સંબંધિત નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેને સમજું છું. જો આ અરજી ફોર્મ સ્વીકારવામાં આવે તો હું અમલમાં હોય એવા જણાવેલા અને બેંક દ્વારા સુધારવામાં આવ્યા હોઇ શકે એ પ્રમાણેના નિયમો અને શરતો દ્વારા બંધનકારક રહીશ અને એલર્ટ સુવિધાનો ઉપયોગ આ નિયમો અને શરતોની સ્વીકૃતિ હોવાનું માનવામાં આવશે. હું સીલબંધ ફોરેક્સ કાર્ડ ક્રિટ પ્રાપ્ત કરી હોવાનું પુષ્ટિ કરું છું.
- હું પ્રમાણિત કરું છું કે આ અરજી ફોર્મમાં પૂરી પાડેલી વિગતો સાચી છે અને હું આ એલર્ટ સુવિધા હેઠળ આવી માહિતી પ્રાપ્ત કરવાની સંમતિ આપું છું. આ નોંધણી ફોર્મમાં ઉપરોક્ત આપેલી કોઇ વિગતો અને માહિતીમાં કોઇ ફેરફારના કિસ્સામાં હું બેંકને સ્વીકાર્ય હોય એ રીતે તેને તાત્કાલિક ધોરણે સૂચિત કરીશ. હું સુવિધા પૂરી પાડવા માટે સમયાંતરે બેંક દ્વારા આવશ્યક અને માગવામાં આવેલી કોઇ વધુ માહિતી પૂરી પાડવા માટે સંમત છું. હું બેંકને સમયાંતરે એલર્ટ સુવિધાને સંબંધિત તમામ સેવા શુલ્ક વસૂલવા માટે અધિકૃત કરું છું.

- હું/અમે સમજીએ છીએ કે એચડીએફસી બેંક ફોરેક્સ કાર્ડ(કાર્ડ્સ)ના ઉપયોગને કડકપણે ચલણ નિયંત્રણ નિયમનો, દેશના કાયદા થવા સમયાંતરે લાગુ થવા પાત્ર નિયમનકારી સત્તાધિકારીઓ અનુસાર હશે, કાર્ડનો ઉપયોગ ફોરેક્સ ટ્રેડિંગ, લોટરી, સ્ટેબાજી, જુગાર, ડેટિંગને સામેલ કરતા એવા કોઇ વ્યવહારો માટે ઉપયોગમાં લેવામાં આવશે નહીં, જેના વિશે હું/અમે મને/અમને પોતાને તેનાથી અપડેટ રાખવાની જવાબદારી લઇએ છીએ અને આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં હું/અમે વિદેશી ચલણ સંચાલન ધારા 1999 અથવા તેના વૈધાનિક સુધારાઓ અથવા તેના પુનઃવધારા હેઠળ કાર્યવાહી કરવા માટે ઉત્તરદાયી હશે.
- જો કોઇ કાર્ડધારક દ્વારા કાર્ડની વિગતો/ પિન કોઇ ત્રાહિત પક્ષોને જાહેર કરવાનાં અને/અથવા પિન/સીવીવી/ઓટીપી વગેરે પ્રાપ્ત કરનાર વ્યક્તિ દ્વારા ફોરેક્સ કાર્ડના દુરુપયોગ કરવાને પરિણામે કાર્ડધારકને થયેલા કોઇ નુકસાન માટે એચડીએફસી બેંક કોઇ પણ રીતે જવાબદાર રહેશે નહીં.
- હું બેંકને સમયાંતરે મારા ફોરેક્સ કાર્ડ સાથે સંબંધિત કોઇ માહિતીને એચડીએફસી બેંકની કોઇ પેરેન્ટ/પેટાકંપની, સંલગ્ન અને સહયોગી, બેંક દ્વારા સામેલ કોઇ ત્રાહિત પક્ષો અથવા કો-બ્રાન્ડિંગ ભાગીદારોને કાર્ડધારકોને કોઇ પ્રચાર અથવા કાર્ડ લાભ કાર્યક્રમમાં એન્રોલ કરવા, એન્ડ-ટુ-એન્ડ ઓફર અથવા રિડિમ્પ્શન પ્રક્રિયાનું સંચાલન કરવા, ગ્રાહક પ્રશ્નો/ફરિયાદો હાથ ધરવા વગેરે જેવા વિભિન્ન ઉદ્દેશો માટે જાહેર કરવા માટે અધિકૃત કરું છું.

X

તારીખ: _____

કાર્ડધારકની સહી

સ્થળ: _____

નામ: _____

યુક્વણીનો પ્રકાર (નીચેનામાંથી કોઇ એક માન્ય)

☐ એચડીએફસી બેંક ખાતા નંબરમાં ડાઇરેક્ટ ડેબિટ _____ અથવા એચડીએફસી બેંક ચેક નંબર _____

☐ અન્ય બેંક ચેક નંબર# _____ (કાર્ડ સક્રિયતા ક્લિઅરિંગ પછી ભંડોળની ઉપલબ્ધતાને આધિન છે.)

પર ડ્રો કરેલ (બેંકનું નામ): _____ શાખાનું નામ: _____

રકમ (આંકડા અને શબ્દોમાં): _____

હું બેંકને મને જારી કરેલ કોઇ પણ પ્રવર્તમાન ફોરેક્સ કાર્ડને બંધ કરવા અને શેષ રકમ (જો કોઇ હોય તો) આ ફોરેક્સ કાર્ડ અરજી ફોર્મની સામે જારી કરેલા નવા ફોરેક્સ કાર્ડમાં ટ્રાન્સફર કરવા અધિકૃત કરું છું. હું જ્યારે શેષ રકમ જૂના કાર્ડમાંથી નવા કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે લાદવામાં આવનારા લાગુ થવા પાત્ર રૂપાંતરણ ફી, વિનિમય દર (જો લાગુ થાય તો) અને વેરાને સ્વીકારું છું.

કાર્ડધારક સાથે સંબંધ: ☐ પોતે ☐ પરિવારના સભ્ય (કૃપા કરીને કાર્ડધારક પાસેથી સત્તાધિકારનો પત્ર બિડો (ત્રાહિત પક્ષના કિસ્સામાં))

કોઇ વ્યક્તિ જો નીચે સૂચવેલી રીતે અન્ય સાથે સંબંધિત હોય માત્ર તો જ અન્ય કોઇ વ્યક્તિના સંબંધી હોવાનું માનવામાં આવશે:

- (1) પતિ

(2) પત્ની

(3) પિતા (સાવકા પિતા સહિત)

(4) માતા (સાવકી માતા સહિત)

(5) પુત્ર (સાવકા પુત્ર સહિત)

(6) પુત્રી (સાવકી પુત્રી સહિત)

(7) ભાઇ (સાવકા ભાઇ સહિત)

(8) બહેન (સાવકી બહેન સહિત)

(9) પુત્રની પત્ની

(10) પુત્રીના પતિ

એચડીએફસી બેંકમાં પ્રવર્તમાન બેંક ખાતું ધરાવતા પરિવારના સભ્ય (ગ્રાહકના પક્ષે ફોરેક્સ કાર્ડમાં ભંડોળ પૂરું પાડવું) પાસેથી ડેબિટ અધિકૃત્તતા:

હું/અમે તમને હસ્તાક્ષર કરેલા ચેક નંબર _____ માંથી મારા/અમારા ખાતા નંબર _____ માંથી ડેબિટ કરવાની અને લાગુ થવા પાત્ર સેવા શુલ્ક અને વેરાની સાથે ઉપરની વિગતો પ્રમાણે ફોરેક્સ કાર્ડમાં ભંડોળ પૂરું પાડવાની અધિકૃત્તતા આપું છું.

ખાતાધારક / પરિવારના સભ્યની સહી:

ખાતાધારક/ પરિવારના સભ્યનું નામ::

બેંકનો ઉપયોગ

પુષ્ટિ કરી છે કે પ્રતિબંધિત યાદીની સામે ખરીદદાર માટે ડી-ડ્યુપિંગ કરવામાં આવી છે. એ પ્રમાણીત કરવામાં આવે છે કે રેમિટન્સ અયોગ્ય સંસ્થાઓ દ્વારા/ને કરવામાં આવી રહ્યું નથી અને રેમિટન્સ સ્કિમ હેઠળ સમયાંતરે રિઝર્વ બેંક દ્વારા જારી કરેલી સૂચનાને અનુરૂપ છે.

શાખાનું નામ _____ શાખા કોડ _____ જારી કર્યાની તારીખ ____/____/ 20____

એલસી કોડ _____ x

એલજી કોડ _____ ઇનપુટરની સહી

એમ્પ્લોઇ આઇડી _____

સ્વીકૃત્તિ

ફોરેક્સ કાર્ડ સંદર્ભ નંબર

તારીખ ____/____/20____. શાખા કોડ ____

લોડ કરેલી ચલણોની વિગતો

ચલણ	એફસીવાય મૂલ્ય	વિનિમય દર	રૂ. મૂલ્ય*
કુલ			

*આખરી કુલ મૂલ્ય ટીસીએસ, જીએસટી, ચલણ રૂપાંતરણ શુલ્ક, જારી કરવાની ફી અને અન્ય લાગુ થવા પાત્ર દર અથવા શુલ્કને આધિન હશે.

ફોરેક્સ કાર્ડમાં લોડ કરેલી કુલ રકમ (રૂ.માં) _____

શાખાના સ્ટાફની સિક્કા સાથે સહી: _____

મહત્વપૂર્ણ નોંધ - ફોરેક્સ કાર્ડ પર આટલું કરો અને આટલું ન કરો

- તમને કાર્ડ પ્રાપ્ત થાય ત્યાર પછી તરત જ તમારા કાર્ડના હસ્તાક્ષર પેનલ પર સહી કરો, જેથી તમે અનધિકૃત વપરાશથી તેને સુરક્ષિત કરી શકો
- કાર્ડનો ઉપયોગ માત્ર મર્યન્ટ વેચાણકેન્દ્રો પર કરો અને મર્યન્ટ વેચાણકેન્દ્ર પર કાર્ડથી કરવામાં આવેલા દરેક વ્યવહારના સમયે વેચાણ રસીદ લેવાનું સુનિશ્ચિત કરો
- તમારા કાર્ડ માટે નેટબેકિંગ સુવિધા સક્રિય કરવા માટે કાર્ડ કિટની સાથે પૂરા પાડેલા આઇપિનનો ઉપયોગ કરો.
- કૃપા કરીને મર્યન્ટ સ્થાપત્યો પર એટીએમ/ઇડીસી ટર્મિનલ દ્વારા જનરેટ કરેલા વ્યવહારોનો રેકૉર્ડ તમારી પાસે રાખો.
- નેટબેકિંગ આઇડીનાં સેલ્ફ-લોકિંગને રોકવા માટે ઉપયોગ કર્યા પછી તમારા નેટબેકિંગ ખાતામાંથી લોગાઉટ કરવાનું સુનિશ્ચિત કરો
- જો તમારું કાર્ડ ખોવાઇ જાય તો કૃપા કરીને તાત્કાલિક ધોરણે ફોન બેકિંગને કોલ કરીને ખોવાઇ ગયું હોવાની જાણ કરો અથવા પ્રિપેઇડ કાર્ડ નેટબેકિંગ સુવિધા મારફતે તમારા કાર્ડને બ્લોક કરો
- કાર્ડનો હોટેલ ડિપોઝિટ્સ, કાર રેન્ટલ ડિપોઝિટ્સ વગેરેની ચુકવણી કરવા જેવા હંગામી શુલ્ક માટે ઉપયોગ કરવો જોઇએ નહીં
- ક્યારેય કોઇ પણ વ્યક્તિને તમારા એટીએમ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર (પિન) અથવા તમારા નેટબેકિંગ આઇપિન જણાવશો નહીં. કાર્ડ મર્યન્ટ વેચાણકેન્દ્ર પર સમાન વ્યવહાર માટે એક કરતા વધુ વખત સ્વાઇપ થવું જોઇએ નહીં
- કૃપા કરીને કાર્ડનો ઉપયોગ એવા મર્યન્ટ વેચાણકેન્દ્રો પર કરશો નહીં, જે કાર્ડ સ્વાઇપ કરતી વખતે તમારા બિલની અધિકૃતતા અથવા પતાવટના સમયે ડીસીસી (ડાઇનેમિક કરન્સી કન્વર્ઝન) વિકલ્પ પસંદ કરતા હોય.
- એચડીએફસી બેંક શાખાઓ ખાતે નિયુક્ત બેંક અધિકારીઓ સિવાય કોઇ પણ વ્યક્તિને કાર્ડ ક્યારેય સોંપશો નહીં અને એ પણ મેગ્નેટિક સ્ટ્રિપ પરથી થોડા ટુકડાઓમાં કાપ્યા પછી સોંપો.
- મેઇલ ઓર્ડર અને ટેલિફોન ઓર્ડર વ્યવહારો માટે કાર્ડનો ઉપયોગ કરશો નહીં.
- કાર્ડનો ઉપયોગ ભારત, નેપાળ અને ભૂતાનમાં ચુકવણીઓ કરવા માટે કરી શકાય નહીં.
- કાર્ડ મર્યન્ટ્સ દ્વારા એડ્રેસ વેરિફિકેશન (એવીએસ) સુવિધાને ટેકો આપતી નથી અને એવીએસ ફરજિયાત હોય એવા મર્યન્ટ વેચાણકેન્દ્રો પર સ્વીકારી શકાય નહીં